

# Third India-Bhutan Development Cooperation Talks

June 28, 2021

## ત્રીજી ભારત-ભુટાન વિકાસ સહકાર મંત્રણા

June 28, 2021

ત્રીજી ભારત-ભુટાન વિકાસ સહકાર મંત્રણા 28 જૂન, 2021ના રોજ વર્ચુઅલ રીતે યોજાઈ હતી. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ શ્રી રાહુલ છાબરા, સચિવ (આર્થિક બાબતો), વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું. ભુટાનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ રોયલ ગવર્નમેન્ટ ઓફ ભુટાનના વિદેશ સચિવ કિંગ્મા સિંગ્મે દ્વારા કરવામાં આવ્યું હતું. ભુટાન ખાતે ભારતના રાજદૂત શ્રીમતી રુચિરા કંબોજે પણ મંત્રણામાં ભાગ લીધો હતો.

દ્વિપક્ષીય વિકાસ સહકાર મંત્રણા એ ભુટાન સાથે ભારતની વિકાસ ભાગીદારીના સમગ્ર આયામને બદલી દેવા માટેનું મહત્વનું દ્વિપક્ષીય મિકેનિઝમ છે. ભારત સરકારે ભુટાનની 12મી પંચવર્ષીય યોજના (2018-2023) દરમિયાન વિકાસ કાર્યોના અમલીકરણ માટે રૂ.4500 કરોડ અને ટ્રાન્ઝિશનલ ટ્રેડ સપોર્ટ ફેસિલિટી માટે રૂ. 400 કરોડ ફાળવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. 12મી પંચવર્ષીય યોજના હેઠળ 77 મોટા અને મધ્યમ સ્તરના પ્રોજેક્ટ તથા 524 સ્મોલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (એસડીપી)/હાઈ ઇમ્પેક્ટ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (એચઆઈસીડીપી) અમલીકરણના વિવિધ તબક્કામાં છે.

ભુટાનની 12મી પંચવર્ષીય યોજના (2018-2023)નું ત્રીજું વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે બંને પક્ષોએ હાલમાં ચાલુ પ્રોજેક્ટ ટાઈડ આસિસ્ટન્સ (પીટીએ) પ્રોજેક્ટની તથા એસડીપી/એચઆઈસીડીપીની હાલની પ્રગતિની સમીક્ષા કરી હતી. ભુટાનના વિદેશ સચિવે ભુટાનના સામાજિક-આર્થિક પરિવર્તનમાં ભારતની ભૂમિકાને બિરદાવી હતી તથા પાયાના સ્તરે એચઆઈસીડીપીની અસરને હાઈલાઈટ કરી હતી. કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખતા ભારતે વિવિધ પ્રોજેક્ટ માટે અગાઉથી ભંડોળ રિલિઝ કર્યું તે વાતને તેમણે બિરદાવી હતી. મંત્રણા દરમિયાન બંને પક્ષો રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, જળ વ્યવસ્થાપન, ઔદ્યોગિક પાર્ક અને કોવિડ-19 મેનેજમેન્ટ સહિતના ક્ષેત્રમાં કેટલાક નવા પીટીએ પ્રોજેક્ટ અમલમાં મુકવા માટે સહમત થયા હતા.

ભારત ભુટાન સાથે પોતાની વિશેષ ભાગીદારીને અત્યંત મહત્વની ગણે છે. ભુટાનને તેના વિકાસના પ્રયત્નોમાં મદદ કરવાનું ચાલુ રાખવા માટે ભારત પ્રતિબદ્ધ છે.

બંને પક્ષ પરસ્પર અનુકુળ તારીખોએ વિકાસ સહકારની આગામી મંત્રણા યોજવા સહમત થયા હતા. બંને દેશો વચ્ચેના વિશેષ સંબંધોને ધ્યાનમાં રાખીને વિકાસ સહકાર મંત્રણા મૈત્રીપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી.

નવી દિલ્હી

જૂન 28, 2021

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.

